

Seat No.:

--	--	--	--	--	--	--

Sl. No. : 101452

207(G)

(March, 2022)

Time : 3 Hours]

[Maximum Marks : 100

સૂચનાઓ :

- 1) આ પ્રશ્નપત્રમાં કુલ 58 પ્રશ્નો છે.
- 2) પ્રશ્નોના જવાબ સૂચના મુજબ આપો.
- 3) પ્રશ્નોની સામે લખેલ અંક ગુણ દર્શાવે છે.
- 4) નવો વિભાગ નવા પાના પર લખો.

વિભાગ - A

નીચે આપેલા 1 થી 20 બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો છે. દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરી લખો. દરેકનો 1 ગુણ છે.

[20]

- 1) કોઈ હિસાબી વ્યવહાર લખવાનો રહી જાય તો તેને કયા પ્રકારની ભૂલ કહેવાય છે ?
(A) સિદ્ધાંતની
(B) વિસરચૂક
(C) ભરપાઈ ચૂક
- 2) બક્ષિસવેરાના કાયદા મુજબ નીચેનામાંથી કઈ બક્ષિસ માની લીધેલ બક્ષિસ ગણાય છે ?
(A) રોકડની બક્ષિસ
(B) હિસાબી ચોપડે નોંધાતી બક્ષિસ
(C) લગ્ન પ્રસંગે આપેલ બક્ષિસ
- 3) ઓડિટ કાર્યનો અંતિમ તબક્કો કયો છે ?
(A) વાઉચિંગ
(B) ચકાસણી
(C) મૂલ્યાંકન

- 4) ઈન્કમેટેક્સ રિફંડનું વાઉચિંગ કરતી વખતે નીચેનામાંથી કયું વાઉચર તપાસવું જોઈએ ?
- (A) ખરીદ બીલ
(B) વેચાણ બીલ
(C) રિફંડનો હુકમ
- 5) સંપત્તિવેરામાં અંગત વાહનો કેટલા સુધી કરમુક્ત છે ?
- (A) ₹ 75,000
(B) ₹ 80,000
(C) ₹ 90,000
- 6) કઈ તપાસમાં થોડા કસોટીરૂપ વ્યવહારોની પસંદગી કરવામાં આવે છે ?
- (A) નિત્ય તપાસ
(B) ચકાસણી
(C) પ્રાયોગિક તપાસ
- 7) આવકવેરાનો કાયદો કઈ સાલથી અમલમાં આવ્યો ?
- (A) 1965
(B) 1961
(C) 1972
- 8) નીચેનામાંથી કઈ વિગત ઓડિટરના કામકાજના કાગળોમાં સમાવેશ થાય છે ?
- (A) પાર્કુ સરવૈયું
(B) ઓડિટ કાર્યક્રમ
(C) શેર હોલ્ડરોની યાદી
- 9) આંતરિક અંકુશની પ્રથા કેવી હોય છે ?
- (A) જડ
(B) કામ ચલાઉ
(C) પરિવર્તનશીલ

- 10) વેચાણમાલ પરત આવે ત્યારે કઈ ચિઠ્ઠી લખવામાં આવે છે ?
- (A) વચન ચિઠ્ઠી
(B) જમા ચિઠ્ઠી
(C) ઉધાર ચિઠ્ઠી
- 11) બક્ષિસવેરો ભરવાની જવાબદારી નીચેનામાંથી કોની હોય છે ?
- (A) બક્ષિસ આપનાર
(B) રાજ્ય સરકાર
(C) બક્ષિસ લેનાર
- 12) આંતરિક અંકુશથી કર્મચારીઓમાં શું કેળવાય છે ?
- (A) સમજણ
(B) નિયમિતતા
(C) બન્ને
- 13) ભારતીય કંપનીધારા પ્રમાણે હિસાબોનું શું કરાવવું ફરજિયાત નથી ?
- (A) ઓડિટ
(B) મૂલ્યાંકન
(C) અન્વેષણ
- 14) કોઈ એક વ્યક્તિએ બીજી વ્યક્તિની તરફેણમાં અવેજ વગર કરેલ મિલકતનું હસ્તાંતરણ શું કહે છે ?
- (A) વેચાણ
(B) ધર્મદો
(C) બક્ષિસ
- 15) કેન્દ્ર કે રાજ્ય સરકારના હિસાબો ઓડિટ કરવાનું કામ કોણ કરે છે ?
- (A) કોમ્પ્રોલર એન્ડ ઓડિટ જનરલ
(B) ઓડિટર
(C) કેન્દ્ર સરકાર

- 16) હિસાબો કોણ રાખે છે ?
 (A) હિસાબનીશ
 (B) ઓડિટર
 (C) શેર હોલ્ડરો
- 17) કઈ પદ્ધતિમાં હિસાબો લખવા તેમજ તપાસવાનું કાર્ય એક સાથે થાય છે ?
 (A) આંતરિક અંકુશ
 (B) આંતરિક ઓડીટ
 (C) પડતર ઓડિટ
- 18) ઓડિટિંગનો આત્મા કોણ છે ?
 (A) મૂલ્યાંકન
 (B) વાઉચિંગ
 (C) ચકાસણી
- 19) નીચેનામાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી ?
 (A) વિસરચૂક ભૂલ
 (B) ખતવણીની ભૂલ
 (C) બેવડી ખતવણી
- 20) પડતરના હિસાબોનું કાર્યક્ષેત્ર કેવું છે ?
 (A) મર્યાદિત
 (B) સાંકળુ
 (C) વિશાળ

વિભાગ - B

■ નીચે આપેલા 21 થી 30 પ્રશ્નોના અતિ ટૂંકમાં જવાબ લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

[10]

- 21) મૂલ્યાંકન એટલે શું ?
 22) સંપત્તિવેરો એટલે શું ?

- 23) અધ્યાપકને મળતા પરીક્ષા મહેનતાણાંની રકમ આવકવેરામાં કયા શીર્ષક હેઠળ મુકવામાં આવે છે?
- 24) બેન્ક ખાતાના વાઉચિંગ વખતે ઓડિટરે શું તપાસવું જોઈએ ?
- 25) ઓડિટરનું કાર્ય શું છે ?
- 26) સતત ઓડિટ ક્યાં અનુકૂળ પડે છે ?
- 27) કસ્ટમ ડ્યુટી કોણ ઉઘરાવે છે ?
- 28) અર્ધવાર્ષિક ઓડિટ ખાસ કયા હેતુથી કરવામાં આવે છે ?
- 29) કઈ આવકોનો સમાવેશ મકાન - મિલકતમાંથી મળતી આવકોમાં કરવામાં આવે છે ?
- 30) ઓડિટ કાર્યક્રમ એટલે શું ?

વિભાગ - C

- નીચે આપેલા 31 થી 44 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. દરેક પ્રશ્નોના 2 ગુણ છે.
(ગમેતે 12)

[24]

- 31) ઓડિટરની નિમણુંક કે પુનઃ નિમણુંક વિશિષ્ટ ઠરાવ દ્વારા થાય તેવી ચાર સંસ્થાઓ જણાવો.
- 32) ચોખ્ખી સંપત્તિ એટલે શું ?
- 33) ઓડિટર ઓડિટ કરતી વખતે કઈ - કઈ નિશાનીઓનો ઉપયોગ કરે છે ?
- 34) અન્વેષણના કોઈપણ બે પ્રસંગો જણાવો.
- 35) સંપત્તિવેરા અન્વયે માની લીધેલી કોઈપણ બે મિલકતો જણાવો.
- 36) ખામીવાળો ઓડિટ અહેવાલ કયા સંજોગોમાં આપી શકે છે ?
- 37) વેચાણવેરાની મુદતીના બે પ્રસંગો જણાવો.
- 38) આંતરિક અંકુશની વ્યાખ્યા આપો.

- 39) ઓડિટના ચાર પ્રકારો જણાવો.
- 40) ઓડિટિંગના કોઈપણ બે લક્ષણો જણાવો.
- 41) પાછલું વર્ષ એટલે શું ?
- 42) ફરીથી વેચાણ (પુનઃ વેચાણ)ના કોઈપણ બે ઉદાહરણ જણાવો.
- 43) કરદાતા એટલે શું ?
- 44) ઓડિટ નોંધપોથીની વ્યાખ્યા આપો.

વિભાગ - D

- નીચેના 45 અને 46 ટૂંકા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. દરેક પ્રશ્નના 3 ગુણ છે. [6]

- 45) ટીમિંગ અને લેડિંગ પદ્ધતિ સમજાવો.
- 46) કંપની ઓડિટરના ગુણો જણાવો.

- નીચેના 47 થી 50 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેકના 4 ગુણ છે. (ગમે તે ત્રણ) [12]

- 47) વેપારીને કર ભરવાની જવાબદારીમાંથી મુક્તિ પ્રાપ્ત થાય તેવા પ્રસંગો જણાવો.
- 48) આકસ્મિક આવક એટલે શું ? આકસ્મિક આવકના ચાર ઉદાહરણ આપો.
- 49) પડતર ઓડિટની લાક્ષણિકતાઓ જણાવો.
- 50) ઓડિટ અહેવાલના ફાયદા જણાવો.

- નીચેના 51 અને 52 પ્રશ્નોના તફાવતલક્ષી જવાબ લખો. દરેકના 4 ગુણ છે. [8]

- 51) નિત્ય તપાસ અને પ્રાયોગિક તપાસ વચ્ચેના તફાવતના ચાર - ચાર મુદ્દા લખો.
- 52) ઓડિટ અને અન્વેષણ વચ્ચેના તફાવતના ચાર - ચાર મુદ્દા લખો.

વિભાગ - E

- નીચે આપેલા 53 થી 58 નિબંધલક્ષી પ્રશ્નોના જવાબ આપો. દરેકના 5 ગુણ છે. (ગમે તે ચાર) [20]

- 53) પગારના શીર્ષક હેઠળ સમાવાતી આવકો જણાવો.

- 54) કંપની ઓડિટરની ગેરલાયકાતો જણાવો.
- 55) આદર્શ અંકુશ પદ્ધતિના લક્ષણો જણાવો.
- 56) પડતર ઓડિટના હેતુઓ જણાવો.
- 57) ગુજરાત વેચાણવેરા સંદર્ભમાં નીચેના શબ્દોની સમજૂતિ આપો. (ગમે તે બે)
- (1) વેપારી (2) માલ
- (3) ખેતી અને ખેડૂત
- 58) ધ્યાના પટેલ એક કંપનીમાં નોકરી કરે છે. નીચેની માહિતી પરથી ગ્રોસ આવકની ગણતરી કરો.
- (1) મૂળ પગાર (માસિક) ₹ 16,000
- (2) મનોરંજન ભથ્થું (વાર્ષિક) ₹ 4,500
- (3) મોઘવારી ભથ્થું - મૂળ પગારના 65% લેખે
- (4) બોનસ - 1 (એક) મૂળ માસિક પગાર
- (5) માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો - મૂળ પગારના 8% લેખે
- (6) માલિક દ્વારા ચૂકવેલ જીવન વિમા પ્રિમીયમ ₹ 3,500

